

**જનસંપર્ક અધીકારી દ્વારા**  
**પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર**  
**ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩**  
**કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦**

તા.૧૫/૫/૨૦૧૭ સોમવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગારધારા હેઠળ ઝડપાયા :-

સમાચાર યાદી નં.૧૦૨૯/૧૭

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૩૧ કેસ કરી ૨૦ વ્યક્તિઓને ઝડપી, ૨૦૨ લીટર દેશી દારૂ કબજે કર્યો હતો. તેમજ જુગારધારા હેઠળ ૦૨ કેસ કરી ૩૧ વ્યક્તિઓને ઝડપી, રોકડ રૂપિયા ૯૯૨૦/- અને જુગારનાં સાધનો કબજે કર્યાં હતા.

તકેદારીના પગલાં હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૦૩૦/૧૭

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલાં હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૧૦ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રો.ઈ.૯૩ મુજબ ૦૬ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

ઘરફોડ :-

સમાચાર યાદી નં.૧૦૩૧/૧૭

સોલા હાઇકોર્ટ : બબ્બનભાઈ રામોદ કોર્ટી (રહે, અખંડ આનંદ સોસાયટી, શાયોના તીલક-૧ પાસે, લાઇફ લાઇન હોસ્પિટલ પાસે, વંદેમાતરમ રોડ, ગોતા, સોલા) એ સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૪/૦૫/૧૭ ના કલાક ૧/૩૦ થી ૬/૩૦ સુધીના સમયગાળા દરમ્યાન પોતાના મકાનનાં મુખ્ય દરવાજાનું તાળુ તોડી, અજાણી વ્યક્તિ ડ્રોઅરમા રાખેલ સોનાનાં દાગીના અને રોકડ રકમ મળી ફૂલ રૂપિયા ૧,૮૫,૦૦૦/- મત્તાની ચોરી કરી, તેમજ પાડોશી સાહેબના ઘરમાથી એક સોનાની ચેન કિંમત રૂપિયા ૩૫૦૦૦/- તથા રોકડા રૂપિયા ૧૦,૪૦૦/- મળી ફૂલ રૂપિયા ૨,૩૦,૪૦૦/- મત્તાની ચોરી કરી લઇ ગઇ છે. આ ગુનાની તપાસ પો.ઈ.શ્રી સી.એલ.સોલંકી ચલાવે છે.

નારણપુરા : વિજય રમણીકલાલ કોઠારી (રહે,હરીપાર્ક સોસાયટી, પાવનપાર્ટી પ્લોટની બાજુમા નારણપુરા) એ નારણપુરા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૩/૦૫/૧૭ રાતના ૯/૪૫ થી તા.૧૪/૫/૧૭ નાં કલાક ૩/૩૦ સુધીના સમયગાળા દરમ્યાન પદમગિરી શોપીંગ સેન્ટરમાં આવેલ ફાલ્ગુની જૈન ગૃહ ઉદ્યોગ નામની દુકાન નંબર.૩ ના આગળના કાચના દરવાજાનું લોક તોડી, શટર ઉચુ કરી, અજાણી વ્યક્તિ દુકાનમાં પ્રવેશ કરી, કાઉન્ટરમા મુકેલ રોકડા રૂપિયા ૧૫,૦૦૦/- તથા સી.સી.ટી.વી કેમેરાનું ડિવીઆર કિંમત રૂપિયા ૨૦૦૦/- ચોરી કરી લઇ ગઇ છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી આર.એલ.પારગી ચલાવે છે.

વાહન ચોરી :-

સમાચાર યાદી નં.૧૦૩૨/૧૭

ગોમતીપુર : નાસીર અબ્દુલરસીદ શેખ (રહે,મીરાનગર ચંડોળા તળાવ પાસે હિમાલયા બેકરીની બાજુમાં દાણીલીમડા) એ તા.તા.૧૪/૫/૧૭ નારોજ ગોમતીપુર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૧/૫/૧૭ બપોરનાં ૧૨/૧૫ વાગ્યાના સુમારે ગોમતીપુર વોરાજીની દરગાહ સામે પુજારીની ચાલીના સામેના રોડ ઉપર પોતાની ઓટોરિક્ષા નંબર GJ-01-BZ-5971 કિંમત રૂપીયા ૪૦,૦૦૦/- મતાની પાર્ક કરી હતી. જેની ચોરી ૪૫ મીનીટમાં થઈ હતી. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી ડી.ટી.ડામોર ચલાવે છે.

આત્મહત્યા :

સમાચાર યાદી નં.૧૦૩૩/૧૭

વેજલપુર : સાનિયા વા/ઓ મોહમદહુસેન શેખ (ઉ.વ.૨૬)(રહે, સંજરીપાર્ક ઝલક ડુપ્લેક્ષની સામે ઝલક કોપ્લેક્ષ જુહાપુરા) તા.૧૪/૫/૧૭ નાં કલાક ૦૦/૧૦ વાગ્યાનાં સુમારે કોઈ કારણોસર પોતાના ઘરે પહેલા માળે થી પડી જતા સાનિયા નું મૃત્યુ નિપજ્યુ હતું. આ અંગે વેજલપુર પોલીસે અકસ્માત મોત નોંધી, આ અંગેની તપાસ મ.સ.ઇ. હરીભાઈ આલાભાઈ ચલાવે છે.

રિવર ફ્રન્ટ (ઇસ્ટ) : ભાવેશભાઈ રાજુભાઈ બજાણીયા (નાયક) (ઉ.વ.૨૩)(રહે,રામકિષ્ણનગર ગૌરીનગરની બાજુમાં વાઘેશ્વરી બસ સ્ટેન્ડ પાસે ચાંદલોડીયા ઘાટલોડીયા) એ તા.૧૪/૫/૧૭ બપોરનાં ૨/૨૫ વાગ્યા પહેલા કોઇપણ સમયે કોઈ અગમ્ય કારણસર દધીચીબ્રીજ નીચે રીવરફ્રન્ટના વોક-વે નજીક નદીનાં પાણીમાં ડુબી જઈ આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે રિવર ફ્રન્ટ ઇસ્ટ પોલીસે અકસ્માત મોત નોંધી, આ અંગેની તપાસ હે.કો.શ્રી મોતીભાઈ તળજાભાઈ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,  
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.  
પોલીસ કમિશનર વતી.